

જાન્યુઆરી 23, 2019

સીટી ઓફ બ્રામ્પટને નાણાકીય અહેવાલ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રામ્પટનને પોતાના સતત 17 માં વર્ષ માટે, શહેરના 2017 [વાર્ષિક નાણાકીય અહેવાલ](#)ની ઓળખ માટે નાણાકીય અહેવાલમાં ઉત્કૃષ્ટતા બદલ કેનેડિયન એવોર્ડ મળ્યો છે.

આ એવોર્ડ યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડાના ગવર્નમેન્ટ ફાઈનાન્સ ઓફિસર્સ એસોસિએશનની (GFOA) પહેલ છે.

એવોર્ડ મેળવવા લાયક બનવા, સીટીને નીચેની જરૂરિયાતો સંતોષવી પડી હતી:

- કેનેડાના ચાર્ટર્ડ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સના (CPA) પબ્લિક સેક્ટર એકાઉન્ટિંગ બોર્ડ (PSAB) દ્વારા નિર્ધારિત સામાન્ય રીતે સ્વીકાર્ય હિસાબી સિદ્ધાંતો (GAAP) માટેની લઘુત્તમ જરૂરિયાતો પટાવવી પડી.
- પારદર્શકતા અને સંપૂર્ણ ખુલાસાની ભાવનાના મૂળમાં, વ્યાપક અને ઉચ્ચ-ગુણવત્તાનો વાર્ષિક નાણાકીય અહેવાલ તૈયાર કરવો.

અવતરણ (ક્વોટ):

“આપણાં કરદાતાઓને આપણી પાસેથી સંપૂર્ણ પારદર્શકતા અને સાબૂત નાણાકીય વ્યવહારોથી ઓછું કશું અપેક્ષિત નથી. નાણાકીય અહેવાલ માટે પ્રતિષ્ઠિત GFOA એવોર્ડ જીતવો એ આપણાં નાગરિકો પ્રત્યે આપણી કટિબદ્ધતાને સમર્થન આપે છે અને આપણે બ્રામ્પટનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણો આકર્ષવાનું ચાલુ રાખવા આપણી છબીને મજબૂત બનાવે છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોક્સ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडान्मक संवाद

सीटी ओफ़ ब्रैम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca